

## FAIRCHEM ORGANICS LIMITED

Regd. Office & Works: 253/P and 312, Village – Chekhala, Sanand – Kadi Highway, Taluka: Sanand, District: Ahmedabad – 382 115, GUJARAT, INDIA Phone (Board Nos.): (02717) 687900, 687901, +91 90163 24095

E-mail: cs@fairchem.in

CIN: L24200GJ2019PLC129759 website: www.fairchem.in

July 5, 2024

#### To, National Stock Exchange of India Limited

Exchange Plaza, Plot No. C/1, G Block, Bandra Kurla Complex, Bandra (East), Mumbai 400051 To, **Department of Corporate Services BSE Limited** 

Phiroze Jeejeebhoy Towers, Dalal Street, <u>Mumbai 400 001</u>

Ourselves: BSE Scrip Code: 543252/NSE symbol: 'FAIRCHEMOR' Ref.: Regulations 30 and 47 of SEBI (LODR) Regulations, 2015

Dear Sirs.

Sub: - Newspaper publication for the attention of the Shareholders of the Company for forthcoming Annual General Meeting of the Company, Deduction of Tax at Source (TDS) on Dividend payment for the F.Y. 2023-24 and updation of their PAN, Email Address, Mobile Number, Choice of Nomination and Bank Account details, etc.

Pursuant to Regulations 30 and 47 of the SEBI (LODR) Regulations, 2015, please find enclosed herewith copy of the publication in newspaper for the attention of the Shareholders w.r.t. forthcoming Annual General Meeting of the Company, Deduction of TDS on Dividend payment for the F.Y. 2023-24 and updation of their PAN, Email Address, Mobile Number, Choice of Nomination and Bank Account details, published in Financial Express, English and Gujarati editions, on July 4, 2024.

We request you to kindly take the above on your record.

Thanking you,

Yours faithfully, For Fairchem Organics Limited

Rajen Jhaveri Chief Financial Officer & Company Secretary ACS - 6615

Encl: As above

indianexpress.com

#### AXTEL INDUSTRIES LIMITED

Regd. Office-Vadodara Halol Highway, Baska, Panch Mahals - 389350, Gujarat, India Email: info@axtelindia.com Website: www.axtelindia.com Tel: +91 2676-247900 CIN:- L91110GJ1991PLCO16185

#### NOTICE

Notice is hereby given to draw kind attention of the shareholders of the Company that Ministry of Corporate Affairs (MCA) vide General Circular No. 09/2023 dated September 25, 2023 read with circulars dated December 28. 2022, May 5, 2022, January 31, 2021, May 5, 2020, April 8, 2020 and April 13, 2020 (collectively referred to as "MCA Circulars") & SEBI Circular No. SEBI/HO/DDHS/P/CIR/2023/0164 dated October 6, 2023 read with SEBI/HO/CFD/PoD2/CIR/P/2023/120 dated July 11, 2023 (collectively referred to as "SEBI Circulars") have further extended the requirement of holding Annual General Meeting through video conferencing (VC) or other audio visual means (OVAM), to send financial statements including Board reports, Auditors report or other documents required to be attached therewith along with Notice of Annual General Meeting to the Members only through email registered with the Company and relaxed the requirement of furnishing hard copy of Annual report to the Members.

We urge the physical shareholders of the Company to complete KYC registration process by downloading required forms by clicking on: https://liiplweb.linkintime.co.in/KYC-downloads.html and submitting signed forms with the Company's Registrar and Transfer Agent Link In Time India Private Limited.

Public advertisement is also available on website of the Company www.axtelindia.com. FOR AXTEL INDUSTRIES LIMITED Place: Nurpura PRERNA BOKIL

Date: 03/07/2024

**Company Secretary & Compliance Officer** 

ORIX LEASING & FINANCIAL SERVICES INDIA LIMITED

(formerly known as OAIS Auto Financial Services Limited) (A Subsidiary of ORIX Auto Infrastructure Services Limited) ORIX Regd. Office: Plot No. 94, Marol Co-operative Industrial Estate, Andheri-Kurla Road, Andheri (E), Mumbai - 400 059 Tel.: + 91 22 2859 5093 / 6707 0100 | Fax: +91 22 2852 8549 Email: info@orixindia.com | www.orixindia.com | CIN: U74900MH2006PLC163937

#### POSSESSION NOTICE [RULE 8(1) SECURITY INTEREST (ENFORCEMENT) RULES, 2002]

Whereas, the undersigned being the authorised officer of ORIX Leasing & Financial Services India Limited, under the Securitization And Reconstruction Of Financial Assets And Enforcement Of Security Interest Act, 2002, and in exercise of powers conferred by section 13(12) of the said act read with rule 9 of THE SECURITY INTEREST (ENFORCEMENT) RULES, 2002 issued a notice dated 19.04.2024 calling upon Hemanshubhai Bhagat, Bhumika Hemanshu Bhagat & Kapilaben Bhagat as borrower/ co-borrowers/ mortgagers to repay the amount mentioned in the notice being INR 22,58,829.63/- (Rupees Twenty Two Lac Fifty Eight Thousand Eight Hundred Twenty Nine And Sixty Three Paise Only) within 60 days of the receipt of the said notice together with further interest and other charges from the date of demand notice till the date of payment/realization.

 The borrowers and co-borrowers despite being served with the said notice and having. failed to repay the entire notice amount together with further interest and other charges. In view of the above, notice is hereby given to the borrowers and public in general that the undersigned has taken symbolic possession of the property described here in under in exercise of powers conferred on him/her under section 13(4) of the said act read with rule 8 of the said rules on 03.07.2024.

The borrowers and co-borrowers in particular and public in general is hereby cautioned. not to deal with the property and any dealing in the property would be subject to the charge of ORIX Leasing and Financial Services India Limited of INR 22,58,829.63/- (Rupees Twenty Two Lac Fifty Eight Thousand Eight Hundred Twenty Nine And Sixty Three Paise Only) together with further interest and other charges from the date of demand notice till the date of payment/ realization.

#### DESCRIPTION OF THE PROPERTY

All That Piece And Parcel Of Land Bearing Plot No. 10 Admeasuring About 50.00 Sq. Mt. Organized On Land Bearing City Survey Nondh No. 2199, 2200/b And 2201 Paikee 2199 Admeasuring About 446.49.34 Sq. Mt. Of Ward No. 2, Rudarpura, Balapir Dargah Within District Surat, The Said Property Is Surrounded By:- East: Adjoining Plot No. 9 West: Adjoining Plot No. 10, North: Road, South: Adjoining Property Date: 03.07.2024

Place: SURAT Yours Faithfully, Loan Account No: LN0000000015794 **Authorised Officer ORIX Leasing & Financial Services India Limited** 

#### M/s. Ester India

Plot No. C-38, Saykha GIDC Industrial Estate, Ta- Vagra, Dist.: Bharuch. Gujarat.

### **Environmental Clearance**

It is hereby informed that the State level Environment Impact Assessment Authority, Gandhinagar, Gujarat has accorded the Environment Clearance for setting up of the proposed manufacturing of Synthetic Organic Chemicals by M/s. Ester India at Plot No. C-38, Saykha GIDC Industrial Estate, Ta-Vagra, Dist.- Bharuch, Gujarat. Vide File no: SEIAA/GUJ/EC/5(f)/792/2024 dated 30th May 2024. A copy of the clearance letter is placed at office of Gujarat Pollution Control Board (Bharuch & Gandhinagar) and may also be seen at website of State level Environment Impact Assessment Authority, Gandhinagar, Gujarat at http://seiaa.gujarat.gov.in/

#### Gujarat State Petronet Limited Corporate Identity Number: L40200GJ1998SGC035188

Reg. Off.: GSPC Bhavan, Sector-11, Gandhinagar-382010, Tel.: +91-79-23268500/ 6670100 Fax: +91-79-23268506, Website: www.gspcgroup.com, E-mail: investors.gspl@gspc.in

#### NOTICE (For the attention of Equity Shareholders of the Company) Transfer of the Equity Shares of the Company to Investor Education and Protection Fund (IEPF) Authority

This Notice is published pursuant to the provisions of the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016

The Rules, amongst other matters, contain provisions for transfer of all Shares in respect of which Dividend has not been paid or claimed by the Shareholders for seven consecutive years or more in the name of Investor Education and Protection Fund (IEPF) Demat Account.

Adhering to the various requirements set out in the Rules, the Company has communicated individually to the concerned Shareholders, whose Shares are liable to be transferred to IEPF Demat Account in respect of the Dividends declared by the Company for the FY 2016-17 up to FY 2022-23 for taking appropriate action(s). The list of concerned Shareholders is also available on the Company's website viz. www.gspcgroup.com under Investor Section.

In case, the Company does not receive any communication from the concerned Shareholders for claim of Dividend on or before 9" October, 2024, the Company shall, with a view to complying with the requirements set out in the Rules, transfer the Shares to the IEPF Demat Account by the due date as per procedure stipulated in the Rules without any further Notice to the Shareholder. Please note that no claim shall lie against the Company in respect of unclaimed Dividend amount and/or Shares transferred to IEPF Authority pursuant to the said Rules.

For shares held in physical mode, kindly send a request to the Registrar and Transfer Agent of the Company, KFIN Technologies Limited with duly filled Investor Request Forms along with supporting documents including original cancelled cheque to update your e-mail address and bank account details. For Demat holders, kindly contact your DP (Depository Participant) and register your e-mail address and bank account details in your Demat account, as per the process

The concerned Shareholder(s) holding Shares in physical form and whose Shares are liable to be transferred to the IEPF Authority, may note that upon transfer of Shares to IEPF Authority, the original Share Certificate(s) which are registered in their name will stand automatically cancelled and be deemed non-negotiable. In case Shares are held in demat form, to the extent of Shares liable to be transferred. shall be debited from the Shareholders account.

The Shareholders may further note that, both the unclaimed Dividend and the Shares transferred to IEPF, if any, can be claimed back by them from IEPF Authority after following procedure prescribed by the Rules.

In case you have any queries or need any assistance may contact any of the

#### **Gujarat State Petronet Limited** Smt. Rajeshwari Sharma Corporate Office:

GSPL Bhavan, E-18, GIDC Electronic Estate, Nr. K-7 Circle, Sector-26, Gandhinagar-382028, Gujarat, India Tel: 079-23268500/600 Email: investors.gspl@gspc.in Website www.gspcgroup.com

#### KFIN Technologies Limited Mr. D Suresh Babu Unit: Gujarat State Petronet Limited

Selenium Tower B, Plot Nos. 31 & 32 Financial District Nanakramguda, Serilingampally Mandal, Hyderabad - 500032, India Ph: +914067161517 Toll Free No.: 1800-3094-001 Email: einward.ris@kfintech.com Website: www.kfintech.com

For Gujarat State Petronet Limited

Rajeshwari Sharma Place: Gandhinagar Company Secretary Date: 03" July, 2024

#### **FAIRCHEM ORGANICS LIMITED** CIN: L24200GJ2019PLC129759

Regd. Office & Works: 253/P & 312, Village Chekhala, Sanand - Kadi Highway, Taluka Sanand, Dist.: Ahmedabad - 382 115

FAIRCHEM E-mail: cs@fairchem.in; Telephone: +91 (02717) 687 900-901 Website: www.fairchem.in **Public Notice** 

Notice is hereby given that the 5th Annual General Meeting ("AGM") of the Members of Fairchem Organics Limited ("the Company") will be held on Monday, August 5, 2024 at 3.30 p.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OVAM), as per the procedure prescribed in General circular No. 20/2020 and 09/2023 dated May 5, 2020 and September 25, 2023 respectively issued by Ministry of Corporate Affairs ("MCA") and SEBI Master Circular No. SEBI/HO/CFD/PoD2/CIR/P/2023/120 dated July 11, 2023 and Circular No. SEBI/HO/CFD/CFD-PoD-2/P/CIR/2023/167 dated October 7, 2023 issued by the Securities and Exchange Board of India ("SEBI") (collectively referred to as 'Circulars'). Companies are allowed to hold their AGMs through VC/OAVM facility, without the physical presence of members at the AGM venue. Hence, the ensuing 5th AGM is being held through VC/OAVM facility to transact the businesses as set out in the Notice convening 5th AGM of the Company.

In compliance with the aforesaid MCA and SEBI circulars, the electronic copies of the Notice of the 5th AGM and Annual Report 2023-24 of the Company, will be sent only by e-mail to all those members, whose e-mail ids are registered with the Company or the Registrar & Share Transfer Agent i.e. Link Intime India Private Limited or with their respective Depository Participants (DPs). Pursuant to the above circulars, the requirement of sending the physical copies of the Annual Report has been dispensed with. Physical copies of the Annual Report 2023-24 will be sent only to those Members who specifically request for the same. The Notice and Annual Report 2023-24 will be available on the Company's website at www.fairchem.in and on the website of BSE Limited at www.bseindia.com and National Stock Exchange of India Limited at www.nseindia.com and also on the website of Link Intime India Private Limited at www.instavote.linkintime.co.in.

#### Manner of registering/updating Email address:

In view of the above, members are requested to register their email ids or changes therein, if any, at the earliest, to receive the Notice of the AGM and the Annual Report electronically and login ID and password for e-voting, electronically as per details given below:

For Shares held in Physical Form

Submit duly filled in and signed Form ISR-1 for registering/updating the Email ID/Mobile number with Link Intime India Private Limited at 5th Floor, 506 to 508, Amarnath Business Centre - 1 (ABC-1), Besides Gala Business Centre, Nr. St. Xavier's College Corner, Off. C.G. Road, Navrangpura, Ahmedabad 380009. The Format of Form ISR-1 is available on the Company's website at Form-ISR-1-Formfor-registering-PAN-KYC-details-or-changes-updation-thereof.pdf (fairchem.in) In case of any query, the member can contact the RTA at +91-79-26465179/86/87 or send an email at ahmedabad@linkintime.co.in

For Shares held in Dematerialised Form Kindly contact your Depository Participant (DP) for updating e-mail id.

#### Manner of registering KYC, Choice of Nomination including the bank details:

For members holding shares in physical mode, the SEBI vide its Master Circular No. SEBI/HO/MIRSD/POD-1/P/CIR/2024/37 dated May 7, 2024 issued to RTAs, has mandated furnishing of PAN, Choice of Nomination, Contact details (Postal Address with PIN, Email ID and Mobile Number), Bank Account details and Specimen signature with the Company / Registrar and Share Transfer Agent. The Members holding shares in physical form are therefore requested to update their KYC with the RTA of the Company by sending duly filled in Form ISR-1 along with the supporting evidences mentioned therein. The Format of the Form ISR-1 is available on the Company's website at Form-ISR-1-Form-for-registering-PAN-KYC-details-or-changes-updation-thereof.pdf (fairchem.in)

The members (in case of holding shares in dematerialised form) are requested to contact their DP for updating their bank account details.

#### Manner of casting vote(s) through e-voting:

The Company will provide the remote e-voting facility to all its members to cast their votes before the AGM or e-voting during the AGM. Instructions of the remote e-voting, e-voting at the time of AGM and detailed procedure for attending the AGM through VC/OAVM facility for the members holdings shares in dematerialized mode, physical mode and for the members who have not registered their e-mail Ids, will be provided in the Notice of the AGM.

Further, pursuant to the provisions of the Income Tax Act, 1961 (the Act), as amended, the dividend paid or distributed by a company on or after April 1, 2020, shall be taxable in the hands of the Members. Therefore, the Company shall be required to deduct Tax at Source (TDS) at the time of the payment of dividend and deposit the same to the credit of the Central Government. No tax will be deducted on the payment of dividend to the resident individual shareholders, if the total dividend to be paid during the financial year does not exceed Rs. 5,000/-.

Tax rate application to a member depends on the availability of PAN, residential status and category of member and the documents submitted by them and accepted by the Company in accordance with the applicable provisions of the Act. Accordingly, the dividend will be paid after deducting applicable TDS, if any. All the members are thereby requested to link their PAN with Aadhaar, update PAN details, any change in residential status and/or category with DPs (in case of shares are held in electronic form) or with RTA (in case of shares are held in physical form), as may be applicable, before the record date i.e. Monday, July 29, 2024.

Application forms for claiming NIL or less rate of TDS by the Resident members (such as Form 15G / Form 15H in case of individuals and self-declaration by entities) and by Non-Resident members (such as Form 10F and Self-declaration) can be downloaded from the https://liiplweb.linkintime.co.in/client-downloads.html > General > Form 15G / 15H / 10F.

To enable us to determine the applicable rate of TDS / withholding tax, you should upload necessary documents at https://liiplweb.linkintime.co.in/formsreg/submission-of-form-15g-15h.html or send by e-mail to cs@fairchem.in on or before Monday, July 22, 2024. No communication on tax determination / deduction shall be considered after July 22, 2024. Further, pursuant to the Finance Act, 2021, Section 206AB of the Act is applicable with effect from July 1, 2021, whereby tax would be required to be deducted at twice the applicable rate in respect of any sum or amount or income paid or payable or credited to a "Specified Person", as defined

Accordingly, the members are requested to note the provisions of the Act. However, the aforementioned withholding of tax at higher rate shall not apply to a Non-Resident who does not have a Permanent Establishment / fixed base in India. The shareholders holding shares in physical folios are requested to note that SEBI vide its Master Circular no. SEBI/HO/MIRSD/POD-1/P/CIR/2024/37 dated May 7, 2024 issued to the Registrar & Transfer Agents and SEBI Circular no. SEBI/HO/MIRSD/POD-1/P/CIR/2024/81 dated June 10, 2024, has mandated that effective April 1, 2024, dividend to the security holders holding shares in physical mode shall be paid only through electronic mode. Such payment to the eligible shareholders holding physical shares shall be made only after they have furnished their PAN, Contact Details (Postal Address with PIN and Mobile Number) Bank Account Details and Specimen Signature for their corresponding physical folios to the Company or the RTA.

An e-mail communication in the matter along with the declaration form is being sent, to those members, whose e-mail Ids are registered with the DPs or with the RTA, as the case may be.

For Fairchem Organics Limited

Date: 03.07.2024 Place: Village: Chekhla, Taluka Sanand,

Dist. Ahmedabad

Rajen Jhaveri **Chief Financial Officer & Company Secretary** 

# indianexpress.com



I get the inside information and get inside the information.

Inform your opinion with investigative journalism.

The Indian Express. For the Indian Intelligent.



Ahmedabad

# એમક્યોર ફાર્માનો આઈપીઓ પ્રથ મદિને જ સંપૂર્ણપણે સબસ્ક્રાઇબ થયો

પીટીઆઈ

નવી દિલ્હી, તા. ૩ લિમિટેડના પબ્લિક (આઈપીઓ) રોકાણકારોની ભાગીદારી વચ્ચે બુધવારે શેર- (આરઆઇઆઇ) વખત સંપૂર્ણપણે સબસ્ક્રાઇબ મળ્યું હતું. થયો છે.

Notice of the AGM.

ઓફરિંગ કેટેગરીમાં ૨.૭૦ ગણો જાહેર ભરણાં માટે ખુલ્લો થેરાપ્યુટિક સંસ્થાકીય સબસ્ક્રાઇબ થયો હતો. જ્યારે રહેશે. પ્રોત્સાહક રિટેલ વ્યક્તિગત રોકાણકારો વેચાણના પ્રથમ દિવસે ૧.૩૨ ક્વોટાને ૧.૩૯ ગણું ભરણું ક્વોલિફાઇડ

એસએસઈના આંકડા ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ

CMS Connecting Commerce

**CMS INFO SYSTEMS LIMITED** 

Regd. Office: T-151, 5th Floor, Tower No.10, Sector-11,

Belapur Railway Station Complex, CBD Belapur, Navi Mumbai - 400 614

 $\textbf{CIN:} \ L45200 \text{MH} 2008 \text{PLC} 180479, \textbf{Website:} \ \underline{www.cms.com}$ 

Email: contact@cms.com, Tel.: +91-22-4889 7400

INFORMATION REGARDING 17th ANNUAL GENERAL MEETING NOTICE is hereby given that the Seventeenth Annual General Meeting

("AGM") of CMS Info Systems Ltd. ("the Company") will be held on Tuesday.

August 6, 2024 at 03:00 PM (IST) through Video Conferencing ("VC") /other

Audio Visual Means ("OAVM") to transact the business as set out in the

In compliance with all the applicable provisions of the Companies Act, 2013

("the Act") and the rules made thereunder, read with Ministry of Corporate

Affairs General Circular Nos. 14/2020 dated April 8, 2020, 17/2020 dated

April 13, 2020, 20/2020 dated May 5, 2020, 02/2022 dated May 5, 2022, 10/2022 dated December 28, 2022 and 09/2023 dated September 25, 2023

and other applicable circulars issued by the MCA (collectively referred to as

"MCA Circulars"), the AGM of the Company will be held through VC/OAVM

facility, without physical presence of the Members of the Company at a

Further, pursuant to the aforesaid MCA Circulars and SEBI Circular Nos. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated May 12, 2020 and subsequent

circulars issued in this regard, the latest being Circular No.

SEBI/HO/DDHS/P/CIR/2023/0164, dated October 06, 2023 (collectively

referred to as "SEBI Circulars"), the Annual Report of the Company for the

Financial Year 2023-24 ("Annual Report") along with the Notice of AGM will

be sent only through electronic mode to those Members of the Company

whose email addresses are registered with the Company/Depository

The Annual Report along with the Notice of AGM will also be made available

on the Company's website at www.cms.com, websites of the Stock

Exchanges, i.e., BSE Limited and National Stock Exchange of India Limited at

www.bseindia.com and www.nseindia.com respectively and website of the

Members can attend and participate in the AGM through VC/OAVM facility

only and their attendance shall be counted for the purpose of reckoning the

quorum under Section 103 of the Companies Act. 2013. The Company will

also be providing to its Members the remote e-voting facility ("remote

e-voting") to cast their votes on all resolutions set out in the Notice of the

AGM. Additionally, the Company will provide the facility of voting through

Detailed instructions for joining the AGM and the detailed procedures for

voting will be provided in the Notice of the AGM. Members who have not

registered their email addresses with the Company/their Depository

Participant are requested to refer to the Notice of the AGM for the process to

be followed for obtaining the User ID and password for casting the vote

In order to receive the Notice of AGM and the Annual Report, Members are

requested to register/update their email addresses by contacting their

respective Depository Participant (DP) with whom such member is holding

Members may note that the Board of Directors, at its meeting held on May

15, 2024, has recommended a final dividend of ₹ 3,25 per equity share of ₹ 10.

each. The dividend, if declared at the AGM, will be paid, subject to deduction.

of tax at source ('TDS'), in electronic form to the registered Bank Account of

the Member, on or after Tuesday, 6th August 2024. The Company has fixed

28th May 2024 as the Record date for determining entitlement of Members

Members who have not updated their bank account details for receiving the

dividends directly in their bank accounts through Electronic Clearing Service

are requested to update their Electronic Bank Mandate with their respective

For CMS INFO SYSTEMS LIMITED

**Company Secretary and Compliance Officer** 

Debashis Dey

for final dividend tor the financial year ended March 31, 2024.

NSDL at <a href="https://www.evoting.nsdl.com">https://www.evoting.nsdl.com</a>.

e-voting system during the AGM ("e-voting").

their demat account.

Date: July 3, 2024

Place: Mumbai

Dividend and Record date:

એમક્ચોર માટેના ફાર્માસ્યુટિકલ્સએ મંગળવારે ઉત્પાદન અને વૈશ્વિક સ્તરે પરસૂચિબદ્ધ થશે.

મુજબ પ્રારંભિક શેર-વેચાણને (ક્ચુઆઇબી) માટેનો હિસ્સો કહ્યું હતું કે તેણે એન્કર ઇનિશિયલ સંસ્થાકીય રોકાણકારો માટેની આઈપીઓ પ જુલાઈ સુધી ફાર્માસ્યુટિકલ્સ કેટલાક મુખ્ય મોર્ગન

માર્કેટિંગમાં સંકળાયેલી ૧,૩૭,૦૩,૫૩૮ શેરની ૭ ટકા સબસ્ક્રાઇબ થયો હતો. રોકાણકારો પાસેથી રૂપિયા છે. કોટક મહિન્દ્રા કેપિટલ બેન કેપિટલ સમર્થિત સામે ૧,૮૦,૨૫,૮૪૦ શેર રૂપિયા ૯૬૦ થી ૧,૦૦૮ ૫૮૩ કરોડની કમાણી કરી છે. કંપની, જેફરીઝ ઈન્ડિયા, એમક્ચોર ફાર્માસ્યુટિકલ્સ માટે બિડ મળી હતી. બિન- પ્રતિ શેરના પ્રાઇસ બેન્ડ સાથે પુણે સ્થિત કંપની એમક્ચોર એક્સિસ કેપિટલ અને જેપી ક્ષેત્રોમાં આઈપીઓના બુક-રનિંગ લીડ કાર્માસ્યટિકલ ઉત્પાદનોની મેનેજર્સ છે. કંપનીના ઇક્વિટી વ્યાપક શ્રેણીના વિકાસ, શેર બીએસઈ અને એનએસઈ



#### કેરકેમ ઓર્ગેનિક્સ લીમીટેડ

CIN: L24200GJ2019PLC129759 **૨જીસ્ટર્ડ ઓફીસ અને વર્કસ :** ૨૫૩/પૈકી અને ૩૧૨, ગામ રોખલા, સાણંદ–કડી હાઇવે, તાલુકો સાણંદ, જિલો અમદાવાદ- ૩૮૨૧૧૫, ભારત **धभेध्यः** cs@fairchem.in **ટेલिફोन** : +69 (०२७९७) ६८७ ६००–६०९ વેબસાઇટ: www.fairchem.in

જાહેર નોટીસ

આથી નોટીસ આપવામાં આવે છે કે ફેરકેમ ઓર્ગેનિક્સ લીમીટેડ (કંપની)ના સભ્યોની પ મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) સોમવાર, પ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ ૩.૩૦ વાગ્યે વિડિયો કોન્ફરન્સ (વીસી)/અન્ય ઓડિયો વિગયુઅલ માધ્યમો (ઓએવીએમ) મારફત , કોર્પોરેટ અફેર્સ મંત્રાલય (એમસીએ) દ્વારા જારી કરાયેલ જનરલ સરક્યુલર નં. ૨૦/૨૦૨૦ અને ૦૯/૨૦૨૩ અનુક્રમે તારીખ ૫ મે, ૨૦૨૦ અને ૨૫ સપ્ટેમ્બર ,૨૦૨૩ અને સિક્યોરીટીઝ અને એક્સચેન્જ બોર્ડ ઓફ્ ઇન્ડિયા (સેબી) દ્વારા જારી કરાયેલ સેબી માસ્ટર સરક્યુલર નં SEBI/HO/CFD/PoD2/CIR/P/2023/120 તારીખ ૧૧ જુલાઇ, ૨૦૨૩ અને સરક્યુલર નં. SEBI/HO/CFD/CFD-PoD-2/P/CIR/2023/167 તારીખ ૭ ઓક્ટોબર, ૨૦૨૩ (એક સાથે સરક્ચુલર્સ તરીકે દર્શાવેલ છે) માં નિયત પ્રક્રિયા મુજબ યોજાશે. કંપનીઓને એજીએમ ખાતે સભ્યોની પ્રત્યક્ હાજરી વગર વીસી/ઓએોએમ સવલત મારફત તેમની એજીએમો ચોજવા મંજુરી અપાઈ છે. પરિણામે, આગામી પમી એજીએમ કંપનીની પમી એજીએમ ગોલાવતી નોટીસમાં જણાવેલ કાર્યો પાર પાડવા માટે વીસી/ઓએવીએમ સવલત મારફત ચોજવામાં આવી રહી છે.

ઉપરોક્ત એમસીએ અને સેબી સરક્યુલર્સના અનુપાલન અંતર્ગત, ૫મી એજીએમની નોટીસ અને કંપનીના વાર્ષિક અહેવાલ ૨૦૨૩–૨૪ની ઈલેક્ટ્રોનિક નકલો તમામ સભ્યોને જેમના ઈમેઈલ આઈડી કંપની અથવા રજીસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટ એટલે કે લિંક ઇન્ટાઈમ ઈન્ડિયા પ્રાઈવેટ લીમીટેડ અથવા તેમના સંબંધિત ડિપોઝીટરી પાર્ટીશીપન્ટો (ડીપી) પાસે રજીસ્ટર્ડ છે તેમને ફક્ત ઈમેઈલથી મોકલવામાં આવશે. ઉપરોક્ત સરક્યુલર્સ અન્વચે, વાર્ષિક અહેવાલોની ફીઝીકલ નકલ મોકલવાની આવશ્યકતામાંથી મુક્તિ અપાચેલ છે. વાર્ષિક અહેવાલ ૨૦૨૩–૨૪ ની ફીઝીકલ નકલો તે માટે ખાસ અરજી કરનાર સભ્યોનેજ મોકલવામાં આવશે. નોટીસ અને વાર્ષિક અંહેવાલ ૨૦૨૩–૨૪ કંપનીની વેબસાઈટ www.fairchem.ii અને બીએસઈ લીમીટેડની વેબસાઈટ www.bseindia.com અને નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ ઓફ ઇન્ડિયા લીમીટેડની વેબસાઈટ www.nseindia.com અને લિંક ઇન્ટાઈમ પ્રાઈવેટ લીમીટેડની વેબસાઈટ www.instavote.linkintime.co.in ઉપર પણ ઉપલબ્ધ રહેશે. ઈમેઈલ એડ્રેસ નોંધણી/સુધારો કરવાની રીત:

ઉપરોક્તને દ્રષ્ટિએ, સભ્યો ઇલેક્ટ્રોનિકલી એજીએમ નોટીસ અને વાર્ષિક અહેવાલ અને ઈ–વોટીંગ માટે લોગીન આઈડી અને પાસવર્ડ મેલવવા માટે વહેલી તકે, તેમના ઈમેઈલ આઈડી અથવા તેમાં જો કોઈ પણ ફેરફાર હોચ તો નોંધણી નીચે આપેલ વિગતો મુજબ કરાવવા વિનંતી છે.

ફીઝીકલ સ્વરૂપે શેરહોલ્ડીંગ માટે

. લિંક ઇન્ટાઈમ ઇન્ડિયા પ્રાઈવેટ લીમીટેડ, પાંચમો માળ, પ૦૬ થી ૫૦૮, અમરનાથ બિઝનેશ સેન્ટર-વ ાલક છટાઇમ ઇાન્ડિયા પ્રાઇપેટ લામાંદડ, પાંચમાં માળા, પેઇટ ટ્રા પેઇટ, ઇમરનાવા ખાર્ગના સન્ટર-પ (એબીસી-૧), ગાલા બિઝનેશ સેન્ટરની બાજુમાં, સેન્ટ ઝેવિચર્સ કોલેજ કોર્નટ પાસે, સી.ઝુ. રોડ, નવરંગપુર, અમદાવાદ- ૩૮૦૦૦૯ માં ઇમેઇલ આઇડી/મોબાઇલ નંબર રજીસ્ટર/સુંદારો કરાવા માટે ફોર્મ આઇએસઆર-૧ ચોગ્ચ રીતે ભરી સહી કરીને જમા કરવું. ફોર્મ નં. ૧નો નમુનો કંનપીની વેબસાઇટ પર Form-ISR-1-Formfor-registering-PAN-KYC-details-or-changes-updation-thereof.pdf (fairchem.in) ઉપર ઉપલબ્ધ છે. કોઈપણ પુંછપે રછ માટે સભ્યો આરટીએનો +૯૧–૭૯–૨૬૪૬૫૧૭૯/૮૬/૮૭ નો સંપર્ક કરી શકે છે અથવ

ahmedabad@linkintime.co.in ને ઇમેઇલ મોક્લી શકે છે.

**ડીમટીરીયલાઇઝડ સ્વરૂપે શેરહોલ્ડીંગ માટે** ઇમેઇલ આઇડી સુધરાવવા માટે તમારા ડિપોઝીટરી પાર્ટીશીપન્ટ (ડીપી) નો સંપર્ક કરવા વિનંતી છે

કેવાયસી, નોમીનેશનની પસંદગી તેમજ બેંકની વિગતોની નોંધણી કરવાની રીત:

ફીઝીકલ સ્વરૂપે શેરહોલ્ડીંગના સભ્યો માટે, સેબીએ તેના માસ્ટર સરક્યુલર નં. SEBI/HO/MIRSD/POD-1/P/CIR/2024/37 તારીખ ૭ મે, ૨૦૨૪ દ્ભારા આરટીએને જારી કરી પાન, નોમિનેશનની પસંદગી, સંપર્ક વિગતો (પોસ્ટલ સરનામું પિનકોડ સાથે, ઇમેઇલ આઇડી અને મોબાઇલ નંબર) બેંક એકાઉન્ટ વિગતો અને નમુનાની સહી કંપની/રજીસ્ટાર અને શેર ટ્રાન્સફર એજન્ટને પુરા પાડવા ફરજિયાત કરેલ છે. ફીઝીકલ સ્વરૂપે શેરહોલ્ડીંગ ધરાવતા સભ્યોને આથી તેમના કેવાચસી કંપનીના આરટીએ પાસે કોર્મ આઈએસઆર-૧ યોગ્ય રીતે ભરીને તેમાં જણવેલ સમર્થન કરતાં દસ્તાવેજો મોકલીને સુધરાવવા વિનંતી છે. ફોર્મ– આઈએસઆર–૧નો નમુનો કંપનીની વેબસાઈટ Form-ISR-1-Formfor-registering-PAN-(YC-details-or-changes-updation-thereof.pdf (fairchem.in) ઉપર ઉપલબ્ધ છે.

સભ્યો (ડીમટીરીચલાઇઝડ સવરૂપે શેરહોલ્ડીંગના કિસ્સામાં) તેમની બેંક એકાઉન્ટ વિગતો સુધરાવવા માટે તેમના ડીપીનો સંપર્ક કરવા વિંનતી છે

કંપની એજીએમ પહેલા તેના તમામ સભ્યોને રીમોટ ઈ-વોટીંગની અને એજીએમ દરમિયાન ઈ-વોટીંગની સવલત પુરી પાડશે. રીમોટ ઈ-વોટીંગ એજીએમના સમયે ઈ-વોટીંગની સુચનાઓ અને ડીમટીરીચલાઈઝડ અને ફીઝીક્લ સ્વરૂપે શેરહોલ્ડીંગ ધરાવતા સભ્યો અને જે સભ્યોએ તેમના ઈમેઈલ એડેસો નોંધણી કરાવેલ નથી તેવા સભ્યો માટે વીસી/ઓએવીએમ સવલત મારકત એજાએમમાં હાજર રહેવાની વિગતવાર પ્રક્રિય એજાએમની નોટીસમાં પુરી પાડવામાં આવશે.

ડિવિડન્ડ પર ટેક્સ:

આ ઉપરાંત આવક વેરા અધિનિયમ– ૧૯૬૧, સુધારેલ ની જોગવાઈઓ અન્વયે, ૧ એપ્રિલ, ૨૦૨૦ ના રોજ અથવા ત્યાર પછી કંપની દ્વારા ચુકવાયેલ અથવા વિતરણ કરાતા ડિવિડન્ડ સભ્યો માટે વેરાપાત્ર ગણાશે. પરિણામે, કંપનીએ ડિવિડન્ડની ચૂકવણી કરતી વખતે, ટેક્સ એટ સોર્સ કપાત કરવાનુ રહેશે અને તે કેન્દ્ર સરકારમાં જમા કરાવવાનું રહેશે. જો નાણાંકિય વર્ષ દરમિયાન ચુકવામાં આવેલ કુલ ડિવિડન્ડ રૂા. ૫,૦૦૦/– થી વધુ ન હોય તો રેસીડેન્ટ વ્યક્તિગત શેરહોલ્ડરોને ડીવીડન્ડની ચુકવણી પર વેરો કાપવામાં આવશે નહી.

સભ્યો માટે વેરા દરની લાગત પાન, રેસીડેન્સીચલ સ્ટેટસ અને સભ્યની કેટેગરી અને એક્ટની લાગુ જોગવાઈઓ મુજબ તેમના દ્વારા જમા કરાયેલ અને કંપની દ્વારા સ્વીકૃત દસ્તાવેજોને આધિન છે. તદ્દઅનુસાર, ડિવિડન્ડ લાગુ ટીડીએસ કપાત પછી ચુકવવામાં આવશે. તમામ સભ્યોને આથી તેમના પાન આધાર સાથે લિંક કરવા, પાન વિગતો, રેસીડેન્સીયલ સ્ટેટસ અને/અથવા કેટેગરીમાં કોઈ ફેરફાર હોય તો ડીપી (ઇલેક્ટ્રીક સ્વરૂપે શેરહોર્લ્ડીંગના કિસ્સામાં) અથવા આરટીએ (ફીઝીકલ સ્વરૂપે શેરહોર્લ્ડીંગના કિસ્સામાં) પાસે, લાગુ પડે તેમ, રેકોર્ડ તારીખ એટલે કે સોમવાર, રલ જુલાઈ, ૨૦૨૪ પહેલા સુધરાવવા વિનંતી છે.

. ટેસીડેન્સીચલ સભ્યો દ્વારા NIL અથવા ટીડીએસના ઓછા દર માટે દાવો કરવા માટે અરજી ફોર્મ (જેમ કે ફોર્મ ૧૫ જી/ફોર્મ ૧૫ એચ, વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા સ્વ દોષણાના કિસ્સામાં) અને બિન નિવાસી સભ્યો દ્વારા (જેવા કેફોર્મ નં. ૧૦એક અને સ્વ–ઘોષણા) https://liiplweb.linkintime.co.in/client-downloads.html > General > Form 15G / 15H / 10F. ા ઉપર થી ડાઉનલોડ કરી શકાશે.

અમને ટીડીએસ/વિથઠોલ્ડીંગ ટેક્સના યોગય દરો નક્કી કરવા માટે સક્ષમ કરવા માટે. તમારે સોમવાર, ૨૨ જ્લાઈ, ૨૦૨૪ ના રોજ અથવા એ પહેલ https://liiplweb.linkintime.co.in/formsreg/submission-of-form-15g-15h.htm પર જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે અથવ cs@fairchem.in ને ઈમેઈલ મોકલવો. ટેક્સ નિર્ધારીતા/કપાત પર કોઈ પત્રવ્યવહાર ૨૨ જુલાઈ, ૨૦૨૪ પછી ધ્યાનમાં લેવામાં આવશે નહી આ ઉપરાંત, ફાચનાન્સ એક્ટ, ૨૦૨૧ અન્વચે, એક્ટની કલમ ૨૦૬એબી ૧ જુલાઈ, ૨૦૨૧ થી લાગુ છે, જેના દ્વારા ટેક્સ નિચત મુજબ સ્પેશીફાઈડ પર્સનને ચુકવવાપાત્ર અથવા ક્રેડીટ કરાયેલ અથવા ચુકવેલ આવક અથવા કોઈપણ રકમના સંબંધમાં લાગુ દરોની કપાત થાય તે જરૂર છે તદ્દરમનુસાર, સભ્યોએ એક્ટની જોગવાઈઓની નોંધ લેવા વિનંતી છે. આમ છતાં, ઉપર જણાવેલ ઉચ્ચ દરે ટેક્સ હોલ્ડીંગ બિન નિવાસી, જેઓ ભારતમાં કાયમી સંસ્થાપન/ફીક્સ્ડ બેઝ ધરાવતા નથી તેઓને લાગુ રહેશે નહી.

કીઝીકલ કોલિયોમાં શેર હોલ્ડીંગ ધરાવતા શેરહોલ્ડરોને નોંધ લેવા વિનંતી છે કે સેબીએ રજીસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટોને જારી કરાચેલ તેના માસ્ટર સરક્યુલર નં. SEBI/HO/MIRSD/POD-1/P/CIR/2024/37 તારીખ ૭ મે, ૨૦૨૪ અને સેબી સરક્યુલર નં. SEBI/HO/MIRSD/POD 1/P/CIR/2024/81 તારીખ૧૦ જુન, ૨૦૨૪ દ્વારા ૧ એપ્રિલ, ૨૦૨૪ થી ફીઝીકલ સ્વરૂપે શેરહોલ્ડીંગ ધરાવતા સિક્યોરીટી હોલ્ડરોના ડિવિડન્ડ ફક્ત ોક્ટ્રોનિક રીતે ચુકવવાનું ફરજીયાત કરેલ છે. ફીઝીકલ શેર્સ ધરાવતા લાયક શેરહોલ્ડરોને આવી ચુ સંબંધિત કીઝીકલ પોર્ટકોલિયો માટે તેમના પાન, સંપર્ક વિગતો (પોસ્ટલ સરનામં પીનકોડ સાથે અને મોબાઈલ નંબર), બેંક એકાઉન્ટ વિગતો અન નમુનારૂપ સહી પુરી પાડે ત્યાર પછી જ ચુકવવાના રહેશે.

આ મામલામાં ઈ–મેઈલ કોમ્ચુનીકેશન તેમજદ્યોષણા ફોર્મ સભ્યોને જેમના ઈમેઈલ આઈડી ડીપી અથવા આરટીએ પાસે રજીસ્ટર્ડ છે તેમને મોકલવામ આવી રહેલ છે.

રાહી/ તારીખ: ૦૩.૦૭.૨૦૨૪ રાજન ઝવેરી ચીક કાચનાન્સિયલ ઓકીસર અને કંપની સેક્રેટરી સ્થળઃ ગામ ચેખલા, તાલુકો સાણંદ

કેઠળ માંગણા નોટીસ(સો) જારી કરીને નીચેના દેવાદાર(રો)ને સંબંધિત નોટીસ(સો) માં જણાવેલ રકમ અ નોટીસ મળ્યાની તારીખથી ૬૦ દિવસની અંદર ચુકવવા જ્ણાવ્યું હતું. કેટલીક નોટીસ(સો)પોસ્ટલ રીમાર્ક મુજ્ળ બજવણી વગર પરત ફરી હતી, પરિણામે આ નોટીસ(સો) બજવણીની વૈકલ્પીક પદ્ધતી એટલે કે અખબારોમાં કાશન મારફત દેવાદાર(રો) ને બજવવામાં આવી રહી છે સિક્યોર્ડ એસેટર લોન એકાઉન્ટ વિગતો

કલમ ૧૩ (૨) હેઠળ માંગણા નોટીસ સિક્ચોરીટાઇઝેશન અને રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ અને

એન્ફોર્સમેન્ટ ઓફ સિક્ચોરિટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ (એક્ટ) અને સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ (નિયમો) હેઠળ

યુનિટી સ્મોલ ફાયનાન્સ બેંક લીમીટેડ (બેંક)ના નીચે સહી કરનાર અધિકૃત અધિકારીએ એક્ટ હેઠળ અને નિયમ 3 સાથે વંસાતી એક્ટની કલમ ૧૩(૧૨) હેઠળ તેમને પ્રાપ્ત સત્તાનો ઉપયોગ કરીને એક્ટની કલમ ૧૩(૨)

યુનિટી સ્મોલ ફાચનાન્સ બેંક લીમીટેડ

રજીસ્ટર્ડ ઓફીસ : બસંત લોક, વસંત વિહાર, નવી દિલ્હી-૧૧૦૦૫૭. કાઉસ, વિદ્યાનગરી માર્ગ, કલિના, સાંન્તાકૃઝ (ઇ) મુંબઇ- ૪૦૦ ૦૯૮.

UNITY Brance

દેવાદાર(રો) નું નામ : ૧) ભગવતી ટેલિકોમ (દેવાદાર) ૨) ઝીઝુંવાડિયા તરુણ એચ.(સંહ-દેવાદાર અને 3) ઝીઝુંવાડિયા રિતીકાબેન તરુણભાઇ (સહ-

<del>એગ્રીમેન્ટ તારીખ:</del> 30/03/૨૦૨૨ લોન એકાઉન્ટ નં. : CFSLSURLOAN000005002502 **લોનની રકમ:** રૂા. ૪,૮૦,૦૦૦/-એનપીએની તારીખ: ૦૪/૦૫/૨૦૨૪ માંગણા નોટીસની તારીખ: ૨૭/૦૫/૨૦૨૪

દસાડા રેવન્યુ સર્વે નં. 3/પૈકી ૧, પ્લોટ નં. ૧૦ થી ૧૪, જેમીન ક્ષેત્રફળ ૩૦૦ ચો.મી. ગાઉન્ડ ફ્લોર, શોપ નં. ૨, ક્ષેત્રફળ ૨૭.૦ ચો.મી., બિલ્ટ અપ એરિયા, ૧૬.૨૦ ચો.મી., તેમજ અને મુકામ-દસાડા મ્યુનિસિપાલિટી એરિયાની સીમા . ાલુકો–દસાડા, જિલો-સુરેન્દ્રનગર ખાતેની સ્થાવર કોમર્સિચલ પ્લોટના તમામ ભાગ અને હિસ્સા. ચતઃસીમા : (ગીરો ડોક્યુમેન્ટ મુજબ) : ઉત્તર : ૨.૭૦ મીટર પ્લોટ નં. ૫૩, દક્ષિણ : ૨.૭૦ મીટર બાજુનો ૬.૦૦ મીટરનો પહોળો રોડ, પુર્વ : ૬.૦૦ (૨૫/૦૫/૨૦૨૪ મુજબ) અને ત્યાજ અને અન્ય સાર્જિસ (૨૫/૦૫/૨૦૨૪ મુજબ) અને ત્યાજ અને અન્ય સાર્જિસ **મોટરની બાજુની શોપ નં. ૧,** મીટરનો બાજુની શોપ નં. ૩, પશ્ચિમ : ૬.૦૦

ું કૈપર જણાવેલ બાકી રકમ ૬૦ દિવસની અંદર પરત ચુકવવામાં નિષ્ફળતાના સંજોગોમાં, નીચે સહી કરનારને એક્ટરની જોગવાદાઓ હેઠળ ઉપરોક્ત સિક્સ્પોર્ડ મિલક્તોને ટાંચમાં લેવાની ફરજપડશે. નોંધ લેવી કે એક્ટની કલમ ૧૩(૧૩) મુજબ તમોને વેચાણ, ભાડે અથવા અન્ય કોઇપણ રીતે અહી દર્શાવેલ સિક્સ્પોર્ડ મિલકતોની સાથે કોઇપણ સોદો અથવા તબદીલી કરવાની મનાઇ ફરમાવામાં આવે છે. આ જોગવાઇઓનો કોઇપણ પ્રકારનો ભંગ

છે ગુનો છે અને એક્ટ હેઠળ સજાપાત્ર છે. માંગણાં નોટીસની નકલ નીચે સહી કરનાર પાસે પ્રાપ્ય છે અને દેવાદાર(રો) જો ઇચ્છે તો નીચે સહી કરના પાસેથી કોઇપણ ચાલુ દિવસે ઓફીસનાં સામાન્ય કલાકો દરમિયાન તે મેળવી શકે છે.

સહી/– અધિકૃત અધિકારી સ્થળ: સુરેન્દ્રનગર, ગુજરાત તારીખ: ૦૪.૦૭.૨૦૨૪ ચુનિટી સ્મોલ ફાચનાન્સ બેંક લીમીટેડ

# zensar

An **RPG** Company

### **Zensar Technologies Limited**

Registered Office: Zensar Knowledge Park, Plot # 4, MIDC, Kharadi, Off Nagar Road, Pune – 411014 Ph: 020-66057500 Fax No.: 020-66057888 **E-mail:** investor@zensar.com **Website:** www.zensar.com CIN: L72200PN1963PLC012621

#### NOTICE

Notice is hereby given that the 61st Annual General Meeting ('AGM') of Zensar Technologies Limited ('Company') will be held through Video Conferencing ('VC')/Other Audio-Visual Means ('OAVM') facility on Friday, August 9, 2024, at 11.00 a.m. IST in compliance with all applicable provisions of the Companies Act, 2013 ('the Act') and rules thereunder and SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ('SEBI Regulations'), as amended from time to time, read with Ministry of Corporate Affairs (MCA) General Circular Nos. 14/2020, 17/2020, 20/2020, 02/2021, 02/2022, 10/2022 and 09/2023 and Securities and Exchange Board of India (SEBI) circular(s) dated May 12, 2020, January 15, 2021, May 13, 2022, January 5, 2023 and October 7, 2023 (hereinafter collectively referred to as 'the Circulars') to transact the business that will be set forth in the Notice calling the AGM.

In compliance with the above-mentioned Circular(s), Notice of AGM and the Integrated Annual Report for FY 2023-24 will be sent electronically, in due course, to all those Members, whose e-mail addresses are registered with the Company or the Registrar and Share Transfer Agent ('RTA') or their respective Depository Participants. The aforesaid documents will also be available on the website(s) of the Company at <a href="www.zensar.com">www.zensar.com</a>, BSE Limited: <a href="www.bseindia.com">www.bseindia.com</a> and National Stock Exchange of India Limited: www.nseindia.com and National Securities Depositories Limited ("NSDL"): www.evoting.nsdl.com. Detailed procedure/instructions for attending AGM, manner of casting vote  $through \, remote \, e\text{-}voting \, or \, through \, e\text{-}voting \, facility \, at \, the \, AGM \, will \, form \, part \, of \, the \, Notice \, of \, AGM.$ Members of the Company who have not registered their email addresses/Bank Mandates can

register the same as per the following procedure:

Physical Holding

Register/update the details in prescribed form ISR-1 and other relevant forms with Company's RTA, KFin Technologies Limited, along with requisite documents. The Company has periodically sent documents along with detailed communication to shareholders for furnishing the requisite details, to update their KYC details. (SEBI Circular No. SEBI/HO/MIRSD/MIRSD-PoD-1/P/CIR/2023/37 dated March 16, 2023). The Investor Service Request form can be downloaded from website of the RTA at https://ris.kfintech.com/clientservices/isc/.

Register/update the details in your demat account, as per the process advised by Demat your respective Depository Participant.

Members are also encouraged to register their bank account details with the RTA/respective Depository Participant(s) to receive the dividend, if and when declared by the Company, directly into the bank account through approved electronic mode of payment. Further details will be provided in the Notice of AGM.

For Zensar Technologies Limited

Place: Pune Date: July 03, 2024

**Manish Tandon CEO and Managing Director** 

This is only an advertisement for information purpose and not for publication, distribution or release directly or indirectly outside India. This is not an announcement for the offer document. All capitalized term used and not defined herein shall have the meaning assigned to them in the Letter of offer dated 10th June 2024 (the "Letter of Offer" or "LOF") filled with the Stock Exchange and namely BSE Limited ("BSE") ("Stock Exchange") and the securities and Exchange Board of India ("SEBI")

એસીએસ-દદ૧૫



# SPRIGHT AGRO LIM

Contact Person: Kanika Kumar, Company Secretary & Compliace Officer • E-mail Address: kansalfiberltd@gmail.com • Website: www.sprightagro.com • Corporate Identity Number: L01100GJ1994PLC117990

## OUR COMPANY IS A PROFESSIONALLY MANAGED COMPANY AND DOES NOT HAVE AN IDENTIFIABLE PROMOTER

## FOR PRIVATE CIRCULATION TO THE ELIGIBLE EQUITY SHAREHOLDERS OF SPRIGHT AGRO LIMITED

RIGHTS ISSUE OF UP TO 3,34.84.611 FULLY PAID UP EQUITY SHARES OF FACE VALUE OF ₹1.00/- (RUPEES ONE ONLY) EACH OF OUR COMPANY (THE 'RIGHTS EQUITY SHARES') FOR CASH AT A PRICE OF ₹13.40 (RUPEES THIRTEEN AND FORTY PAISA ONLY) PER RIGHTS EQUITY SHARE (INCLUDING A PREMIUM OF ₹12.40 (RUPEES TWELVE AND FORTY PAISA ONLY) PER RIGHTS EQUITY SHARE) ÁGGREGATING UP TO ₹4486.94 LAKHS\* ON A RIGHTS BASIS TO THE ELIGIBLE EQUITY SHAREHOLDERS OF OUR COMPANY IN THE RATIO OF 1 (ONE) RIGHT EQUITY SHARE FOR EVERY 15 (FIFTEEN) FULLY PAID UP EQUITY SHARE HELD BY THE ELIGIBLE EQUITY SHAREHOLDERS ON THE RECORD DATE, THAT IS ON 7th JUNE, 2024 (THE 'ISSUE'). FOR FURTHER DETAILS, SEE 'TERMS OF THE ISSUE' BEGINNING ON PAGE 151. THE RIGHTS ISSUE PRICE IS 13.40 TIMES THE FACE

#### DATES FOR RECEIPT OF RIGHTS ISSUE APPLICATION FORMS HAS BEEN EXTENDED AS FOLLOWS

ENEVIS	PREVIOUS DATE	EXTENDED DATE
<b>Last Date for On Market Renunciation*</b>	<b>MONDAY, JULY 08, 2024</b>	<b>TUESDAY, JULY 16, 2024</b>
Issue Closing Date	FRIDAY, JULY 12, 2024	<b>TUESDAY</b> , <b>JULY 23</b> , <b>2024</b>

Making of an Application through the ASBA process

An Investor, wishing to participate in this Issue through the ASBA facility, is required to have an ASBA enabled bank account with an SCSB, prior to making the Application. Investors desiring to make an Application in this Issue through ASBA process, may submit the Application Form in physical mode to the Designated Branches of the SCSB or online/ electronic Application through the website of the SCSBs (if made available by such SCSB) for authorizing such SCSB to block Application Money payable on the Application in their respective ASBAAccounts.

Investors should ensure that they have correctly submitted the Application Form and have provided an authorization to the SCSB, via the electronic mode, for blocking funds in the ASBA Account equivalent to the Application Money mentioned in the Application Form, as the case may be, at the time of submission of the Application. For the list of banks which have been notified by SEBI to act as SCSBs for the ASBA process, please refer to https://www.sebi.gov.in/sebiweb/other/OtherAction.do?doRecognisedFpi=yes&intmld=34

PLEASE NOTE THAT ONLY RESIDENT INVESTORS CAN SUBMIT THEIR APPLICATION USING THE ASBA PROCESS ONLY. ASBA FACILITY IS OPERATIONAL FROM THE ISSUE OPENING DATE.

LAST DATE FOR APPLICATION:

This is to inform that the Eliqible Equity Shareholders of the Company that the date of closure of the Rights Issue, which opened for subscription on Monday, June 24, 2024 and scheduled to be close on Friday, July 12, 2024, has now been extended by the Company from Friday, July 12, 2024 to Tuesday, July 23, 2024, vide the resolution passed by the Rights Issue Committee meeting dated Wednesday July 03, 2024, in order to provide an opportunity to

Accordingly, the last date of submission of the duly filled in Application Form is Tuesday, July 23, 2024, i.e., Issue Closing Date.

ALLOTMENT ONLY IN DEMATERIALISED FORM The Allotment of Equity Shares pursuant to the Issue will only be made in dematerialised form. In accordance with the SEBI Rights Issue Circulars, (a) the Eligible Equity Shareholders, who hold Equity Shares in physical form as on Record Date; or (b) the Eligible Equity Shareholders, who hold Equity Shares in physical form as on Record Date and who have not furnished the details of their demat account to the Registrar or our Company at least two Working Days prior to the Issue Closing Date, desirous of subscribing to Rights Equity Shares may also apply in this Issue during the Issue Period subject to certain conditions. Such resident Eligible Equity Shareholders must check the procedure for application by and credit of Rights Equity Shares to such Eligible Equity Shareholders in Terms of the Issue - Making of an Application by Eligible Equity Shareholders holding Equity Shares in physical

form" and "Terms of the Issue - Allotment Advice or Refund/Unblocking of ASBA accounts" beginning on pages 151, respectively of the Letter of Offer. FURTHER, THERE IS NO SUCH CHANGES IN THE LETTER OF OFFER, ABRIDGED LETTER OF OFFER, ENTITLEMENT LETTER AND APPLICATION FORM. EXCEPT, FOR MODIFICATION IN THE ISSUE CLOSING DATE, ON-MARKET RENUNCIATION DATE AND RESULTANT CHANGE IN THE APPLICABLE DATE AND INDICATIVE TIME TABLE OF POST ISSUE ACTIVITIES ON ACCOUNT OF EXTENSION OF ISSUE CLOSING

Unless otherwise specified, all capitalised terms used herein shall have the same meaning ascribed to such terms in the Letter of Offer

Place: Ahmedabad : July, 03, 2024 Date

On behalf of Board of Directors For, Spright Agro Limited, Sd/- Akshaykumar N. Patel - Managing Directo